



Updates/GST/Legal-07/2022

Dt. 04/07/2022

Important updates from

Dt. 01/06/2022 to 04/07/2022

**Legal Branch
Office of the Chief Commissioner,
State tax, Gujarat**

અપડેટમાં સમાવેશ કરવામાં આવેલ બાબતો

અનુ નં.	વિષય
૧	જીએસટી કાયદા હેઠળ જારી કરવામાં આવેલ નોટીફિકેશન અન્વયેની અગત્યની જોગવાઈઓ
૨	જીએસટી પોર્ટલ દ્વારા જુન-૨૦૨૨ દરમિયાન જારી કરવામાં અપડેટ્સ/News
૩	જુન-૨૦૨૨ દરમિયાન આપવામાં આવેલ એડવાન્સ રુલીંગ



૧. જીએસટી કાયદા હેઠળ કરવામાં આવેલ નોટીફિકેશન અન્વયેની અગત્યની જોગવાઈઓ:

૧.૧ પત્રક ફોર્મ GSTR-4ની લેટ ડીમાં માફી:

- કોમ્પોઝીશન વિકલ્પ પસંદ કરેલ હોય તેવાં કરદાતાઓ માટે નાણાંકીય વર્ષ ૨૦૨૧-૨૨ માટે વાર્ષિક ધોરણે રજૂ કરવાના થતાં પત્રક ફોર્મ GSTR-4 મોડા રજૂ કરવા માટે તા. ૦૧/૦૫/૨૦૨૨ થી તા. ૩૦/૦૬/૨૦૨૨ ના સમયગાળા સુધીની લેટ ડી સંપૂર્ણ માફ કરવામાં આવી.

[નોટીફિકેશન નં. ૦૭/૨૦૨૨-સ્ટેટ ટેક્સ તા. ૦૬/૦૬/૨૦૨૨]

૧.૨ ઇ-કોમર્સ ઓપરેટરને વ્યાજમાં માફી:

- ઇ-કોમર્સ ઓપરેટરોએ પોતાનાં મારફત કરવામાં આવેલ સપ્લાય તેમજ પોતે ઉઘરાવેલ વેરાની વિગતો જે-તે માસ પૂર્ણ થયાનાં ૧૦ દિવસમાં સ્ટેટમેન્ટ ફોર્મ GSTR-8 માં રજૂ કરવી આવશ્યક છે.
- કેટલાંક ઇ-કોમર્સ ઓપરેટરોએ સપ્ટેમ્બર-૨૦૨૦ થી જાન્યુઆરી-૨૦૨૧ નાં સમયગાળા માટે ઉઘરાવેલ વેરો કેશ લેજરમાં જમા કરાવી દીધેલ. પરંતુ, તકનીકી ખામીને કારણે સમયસર તેઓ સ્ટેટમેન્ટ ફોર્મ GSTR-8 રજૂ કરી શક્યા ન હતાં, જેથી વેરાની રકમ વ્યાજ સાથે ચૂકવવાની થતી હતી.
- ઉક્ત ઇ-કોમર્સ ઓપરેટરોએ ઉઘરાવેલ રકમ કેશ લેજરમાં જમા કરાવેલ હોય તે તારીખથી સ્ટેટમેન્ટ ફોર્મ GSTR-8 રજૂ કર્યાની તારીખ સુધીનાં સમયગાળા માટે કેન્દ્ર સરકાર દ્વારા સીજીએસટી કાયદા હેઠળ વ્યાજમાં માફી આપવામાં આવેલ છે.
- આથી, ઉક્ત ઇ-કોમર્સ ઓપરેટરો પૈકી રાજ્યમાં નોંધાયેલ હોય તેવાં ઓપરેટરોને જીજીએસટી કાયદા હેઠળ વ્યાજમાં માફી આપવામાં આવી.

[નોટીફિકેશન નં. ૦૮/૨૦૨૨-સ્ટેટ ટેક્સ તા. ૦૨/૦૭/૨૦૨૨]



૨. જીએસટી પોર્ટલ દ્વારા મે-૨૦૨૨ દરમિયાન જારી કરવામાં અપડેટ્સ:

Availing ITC as per law and GSTR-2B:

- For some of the taxpayers, there was an issue in relation to duplicate entries in GSTR2B which has since been fixed and correct GSTR 2B has been generated.
- In this regard, taxpayers while filing GSTR3B are advised to check and ensure that the value of ITC they are availing is correct as per the law.
- They may check the correct ITC value from download of Auto drafted ITC statement GSTR2B or pdf of System Generated GSTR3B or on the ITC observed on the mouse hover of Table 4 in GSTR3B, particularly in any such case where there is any difference observed between the correct figures available at places as stated above and the prefilled GSTR3B observed on screen.



3. જુન-૨૦૨૨ દરમિયાન આપવામાં આવેલ એડવાન્સ રુલીંગ:

M/s. Amnex Infotechnologies Pvt. Ltd

Sr. no.	Advance Ruling sought for	Ruling
1.	Questions on which Advance Ruling sought: What is the rate of GST applicable on Applicant for provision of services provided to Shahjahanpur Nagar Nigam (Local Authority) regarding Intelligent Traffic Management System (ITMS)?	1. The said supply is leviable to 12 % IGST.
2.	Which is the correct HSN / SAC code?	2. SAC is 995468

M/s. Dishman Carbogen Amcis Limited

Sr. No.	Advance Ruling sought for	Ruling
1	On what value, the new car purchase by the company is sold after using it for business purpose, shall the GST be charged?	<ol style="list-style-type: none"> 1. The Value for intended supply shall be the difference between the consideration received for supply of said car and the depreciated value of the said car on the date of supply. Depreciation is as per Section 32 Income Tax Act. 2. GST rate leviable is 18% (9% CGST & 9% SGST). 3. Valuation & GST rate of intended supply is as per Ruling at sr no 1 & 2. 4. Valuation, as per Explanation (i) to said Notification 8/2018-CT(R), is exclusive of GST.
2	At what rate of GST, the new car purchase by the company is sold after using it for business purpose, shall the GST be charged?	
3	Whether the value of old and used car, sold by the company as mentioned above, can be taken as the value that represent margin of the supplier, on supply of such car, and whether the GST can be charged on such margin?	
4	The value that represent margin of the supplier, on supply of such old and used goods/Car will be inclusive of GST or exclusive?	

M/s. Vadilal Enterprises Ltd.

Sr. No.	Advance Ruling sought for	Ruling
1	Who is the person liable to pay GST for transportation of goods of customers located by an independent agency engaged by the applicant, while refrigerated vehicles used for transportation of the applicant's goods travelled back on return journey, after unloading and delivering the applicant's goods at the destination?	<p>1. M/s Vadilal is not a Goods Transport Agency. In this specific scenario presented before us, Vadilal supplies Business Support Service to Celcius (independent agency) and the tax liability is on forward charge. Further, in view of this Ruling, We hold that Vadilal has no locus standi to seek a Ruling on the which person is liable to pay GST on the activity/ service M/s Celcius supplies to its (Celcius) customers.</p> <p>2. Same as above Ruling.</p> <p>3. M/s Vadilal is liable to pay GST under RCM on the freight charges paid to its transporter as expounded in para 15.</p> <p>4. ITC on GST paid on the transaction wherein refrigerated vehicles returned empty during return journey is admissible to M/s Vadilal as expounded in para 16.</p>
2	Who is the person liable to GST for transportation of goods of the customers located by an independent agency when the vehicles used for transportation of the applicant's goods are used for further transportation, after unloading the applicant's goods at the destination of the applicant's branches or depots?	
3	Who is the person liable to pay GST in respect of goods transport agency service used for bringing back empty plastic trays belonging to the applicant from various places (like branches or depots) to the applicant's premises?	
4	Whether the applicant can avail Input Tax Credit of the entire amount of GST paid on the transaction of the applicant's goods in refrigerated vehicles although such vehicles travel empty (i.e. without the applicant's goods being loaded therein) during the return journey?	

આભાર

નોંધ:

- a) ઉક્ત નોટીફિકેશન્સ અને એડવાન્સ રૂલીંગ ડિપાર્ટમેન્ટની વેબ સાઈટ પર મુકેલ છે, જેનો અભ્યાસ કરવા વિનંતિ.
- b) પ્રસ્તુત બાબતે જો કોઈ અસ્પષ્ટતા હોય તો ડિપાર્ટમેન્ટની કાયદા શાખાનો સંપર્ક કરવા વિનંતિ છે.